

॥ तस्य वाचकः प्रणवः ॥

स्तर-भरा

आत्मनो हिताय ज्ञातः सुखाय



‘योग’ लिखा लावीओ, ‘लिखु’ बनी गुरुद्वार;
मुमुक्षु ज़र पामશે, સૌનો મુજમાં ભાગ.

સેવા ! પ્રમ ! ધ્યાન ! સાક્ષાત્કાર !

* ધ જનસેવા એરીટેબલ ડિસ્પેન્સરી *

(હેતુ : મુક્ત સેવા)

સ્થાપક :-

શ્રી સ્વામી સુન્દરાનંદ
(ડૉ. સ્વામી, ઎. એમ, બી. એસ.)
(જનારસ)

દેણનાથ મહાર્દી,
મુ. પે. બીડજ,
જ. પેડા, ગુજરાત.
તા. ૧૫-૭-૮૬

પ્રિય અને પૂજય આત્મસ્વરૂપ (યોગબિક્ષુણ)

પ્રણામ
પત્ર મળ્યો. આભાર.

સત્ગતિ કરાવે તે સત્ગુરુ. જીવનમાં વિકાસ અને ઉલ્લાસ પામવા
સત્ગુરુની મદ્દ બહુ જ જરૂરી છે.

આમુખ પરિવારના શ્રી યોગબિક્ષુ એક સમર્થ સંતપુરૂષ છે. સ્વયમુ
એક ત્યાણી-યોણી અને ઉપયોણી મહાત્મા છે. યોગબિક્ષુ જેવા સત્ગુરુ
ભાયશાળાનિને જ મળશે કારણ કે તેઓ ચંદ્ન જેવા એક હુર્લાભ વ્યક્તિ
છે. તેમના શિષ્ય થવામાં એક ગૌરવ છે.

સેવા અને અનુકરણથી ગુરુ ખુશ થાય છે અને શિષ્યને મદ્દ કરે છે.
તેથી તન-મન-ધનથી ગુરુણ સાથે એકાત્મ-ભાવ કુળવીએ.

ગુરુનું પ્રિય-પાત્ર પામીએ. ગુરુનું પ્રતિબિંબ બનીએ. ગુરુની ઝરોક્ષ
કોપી થઈને જીવીએ.

..... આજથી શ્રી યોગબિક્ષુની ઝરોક્ષ કોપી બનો. આપ સોં
ત્યાણી-યોણી-ઉપયોણી થઈ જીવનને ધન્યમય અને ઉલ્લાસમય બનાવો.

આમુખ તત્ત્વ : સત :

એજ દી,
તમારો જ આત્મા,
સુન્દરાનંદ

તૃત્યાંત

(અતમભરા ચેરલે અનુભવયુક્ત સત્યથી ભરેલું)

(ખડુજનહિતાય-ખડુજનસુધાય)

અંક - ૪

વર્ષ : ૬

માનદુ તંત્રી - નૈપથ વ્યાસ

મુઠ્ઠા

(પાતંજલ યોગદર્શિન - સમાધિપાદ)

(પ. પૂ. શુરુદેવ શ્રી યોગબિક્ષુજી દ્વારા આવેખાયેલ “મુઠ્ઠા” પુસ્તકમાંથી સાભાર)

ચિત્તને એકાશ કરવાના, ચિત્તને પ્રસન્ન રાખવાના જુહા જુહા ઉપાયો પતંજલિ સુનિશ્ચ યોગદર્શિનના સુમાધિપાદના તેત્રીસથી યોગબ્યાદીસ સ્થૂલોમાં વળ્ણુંયા.

સુખીમાં ભિત્તાની, હુખીમાં કરુણાની, પુષ્યશાળીમાં ઝર્ણની અને પાખીમાં ઉદ્ઘાસીનતાની ભાવના રાખવાથી ચિત્ત પ્રસન્ન રહે છે; અથવા તો પ્રાણુને (શાસને) વેગથી બાહાર હુંકીને બાહાર જ ધારણું કરી રાખવાથી ચિત્તની એકાશતા પ્રાપ્ત કરી શકાય, અથવા તો વિષયવાળી પ્રવૃત્તિ ઉત્પન્ન કરીને તેમાં ચિત્તને જેડી દેવાથી ચિત્ત એકાશ રહે છે; અથવા તો જાનરૂપી જ્ઞાતિના

પ્રગટ થવાથી શોકરહિત થઈને એકાશ થઈ જવાય છે; અથવા તો ચિત્તને વિપયોગાંથી રાગરહિત કરીને એકાશતા-પ્રસન્નતા મેળવવી; અથવા તો સ્વર્ગ અને નિદ્રાજીનનું આલંબન લેવાથી એકાશતા પ્રાપ્ત થઈ શકે છે; અથવા તો જે ખૂબ કુચિકર હોય અને શાસ્ત્રની રીતે યોગ્ય હોય તેનું ધ્યાન કરવાથી એકાશતા-પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.

ઉપરના ઉપાયો મનને સ્થિર કરવા માટેના બતાવ્યા અને જ્યાધિ, સ્ત્ર્યાન વરેરે જે વિધને હતાં તેને દૂર કરવા માટે એકતરવનો અભ્યાસ બતાવ્યો.

તંત્રીસ્થાનેથી

વાચકમિત્રો,

કેટલાક વાગ્કોના સૂચનને લક્ષમાં લઈને “ તૃત્યાંત ”ના ડિસેમ્બર-૧૯ માસનો અંક ચુરણતાથી વાંચી શકાય તેવા મોટા અક્ષરોમાં પ્રગટ કરવામાં આવ્યો. આ અંકને ખૂબ સારો આવકાર મળ્યો છે, અને તેથી જ હવે પણીના અંક સહેતાધીથી વાંચી શકાય તેવા મોટા અક્ષરોમાં પ્રગટ કરવાનો પ્રયત્ન કરીશું.

આપસી યો વાતથી વાકેદ જ છો કે “ તૃત્યાંત ”નો આ અંક આ વર્ષનો છેલ્દો અંક છે, દર વર્ષે કુલ ચાર અંક - જુલાઈ, સપ્ટેમ્બર, ડિસેમ્બર અને એપ્રિલ માસમાં પ્રગટ કરવામાં આવે છે.

આ વર્ષનો આ છેલ્દો અંક હોઈ દરેક વાચકને વિનંતી કે નવા વર્ષમાં સભ્ય જનનાર સૌ કોઈએ પોતાનું લવાજમ તા. ૩૧-૫-૬૦ પહેલાં મોકલાવી હેલું.

સાધનામાં આવતાં વિદ્ધનોને પ્રતિરોધ કરવા માટે, તેને ટાળવા માટે, તેને દૂર કરવા માટે એકતરવનો અભ્યાસ કરવો. આ એકતરવ શું છે? થાથી, પરમતત્ત્વ એક છે. તમામનો સુમાવેશ તે એકતરવમાં થઈ જાય છે. તેનું ધ્યાન કરવું, તેમાં મનને સ્થિર કરવું, તેની ઉપાસના કરવી, તેનામાં જાય થઈ જતું. આમ કરવાથી આ તમામ પ્રકારનાં વિદ્ધનો નાશ પામી જાય છે અને સ્થળ રીતે સમજુયે તો ધ્યાનમાં કોઈ એક સ્થળ પહાર્થનો આપણો લઈ એકાગ્ર થવું. આમ જે રીતે, સાધનામાં આવતાં વિદ્ધનોને દૂર કરવાના ઉપાયો પતંજલિ સુનિયો અતાવ્યા. પછી અતાવ્યા મનને-ચિત્તને સ્થિર કરવાના ઉપરોક્ત ઉપાયો. તે બધા ઉપાયોને આપણે જાય અંકમાં વિગતવાર વર્ણાવી ગયા.

તો, બધાં જ વિદ્ધનો, વિક્ષેપો, અંતરાયો અને ઉપાંતરાયો દૂર થઈ જવાથી અને ચિત્તને એકાગ્રતાની ચોય્યતાવાળું બનાવી હેવાથી જેણી પ્રાપ્ત થાય છે, તે પ્રાપ્તિની વાત આ ચાલીસમાં સૂત્રમાં આવે છે.

પરમાણુપરમમહત્ત્વાન્તોડસ્ય વશીકાર: ૧૪૦
આવાર્થિ :- અતિધાર્ણ નાતું અને અતિધાર્ણ મોટું, અતિધાર્ણ સૂક્ષ્મ અને અતિધાર્ણ સ્થળ તે બધાને ખૂણ સારી રીતે સમજ શકે તેવો મનનો કાળું આવી જાય છે.

વિસ્તાર :- જ્યારે, આગળ વર્ણાવ્યાં તે સાધનામાંથી કોઈ પણ એકનો આશ્રય લઈ એકાગ્રતા પ્રાપ્ત કરી લેવામાં આવે છે જ્યારે મનમાં કેવી ચોય્યતા જન્મે છે? તે મન કેરણ બધું ચોય્ય થઈ જાય છે? પરમાણુથી માંડી પરમ મહત્ત્વ સુધી કોઈ પણ પહાર્થમાં તે મનને લગાડીયે તો તેમાં તે ચાંટી જાય છે અને તેનું તારતમ્ય આપી હે છે, તેનો છેવનેનો નિયોગ તે આપણી સમક્ષ રજૂ કરી હે છે. આવી મનની ચોય્યતા થઈ જાય છે. જ્યારે ચિત્ત-મન એક-

ચિત્તાની ચોય્યતાવાળું થઈ જાય જ્યારે તે મનમાં એવી શક્તિ આવે છે, એવી ચોય્યતા આવે છે કે પછી એ મનને પરમાણુ (પરમાણુ કહેતાં નાનામાં નાનો પહાર્થ કે જેનાથી પછી નાતું કાંઈ હોઈ જ ન શકે) અને પરમમહત્ત (મોટામાં મોટું કે જેનાથી પછી કોઈ મોટું હોઈ જ ન શકે) માં લગાડો તેમાં પણ મન લાગી જાય છે.

પહાર્થમાં સૌથી મોટામાં મોટું આકાશ અને ચૈતન્યમાં મોટામાં મોટું પરમતત્ત્વ. પરમાણુ માટે પણ પરમાત્મા કહી શકાય અને પરમમહત્ત માટે પણ પરમાત્મા કહી શકાય. પરમાણુ એવું “સૂક્ષ્મમાં સૂક્ષ્મ” અને પરમમહત્ત એવું “સર્વ જગતાંયે બધાગેતું” એવો અર્થ કહીએ તો તેનો અર્થ પરમચૈતન્ય તત્ત્વ જાય.

એ નાનામાં નાના જડ પહાર્થમાં કે મોટામાં મોટા જડ પહાર્થમાં મન હેડે તો તે તેમાં ચાંટી જાય અને તેમાં શું છે તેની ખબર પડી જાય. અને એ પરમાણુમાં એવલે કે પરમસૂક્ષ્મમાં અને પરમમહત્ત એવલે કે પરમવિશાળ, સર્વબ્યાપક એવું કે તત્ત્વ (કે પરમસૂક્ષ્મ છે, કે ધિન્દ્રિયોની અગોચર છે, જલહી સમજમાં ન આવે એવું સૂક્ષ્મ અને સર્વબ્યાપક કે તત્ત્વ), તેમાં પણ એ મનને રોડે તો તેના વિષેની માહિતી એવલે કે તેના વિષેનો પણ સાચો જ્યાલ આપી હે. આટલી અને આવી સિદ્ધિને મન પ્રાપ્ત કરી લે છે.

એકાગ્ર થયેલા મનનો એવો અધિકાર થઈ જાય છે કે પરમાણુથી માંડીને પરમમહત્ત સુધી તે પહોંચી શકે છે, તેમાંસ્થિર થઈ શકે છે, તેમાં જે કાંઈ હોય તેની માહિતી આપી શકે છે. મનચિત્તનો - મન-ચિત્ત ઉપર આવો કાળું આવી જાય છે, આવી એકાગ્રતા પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે આવી એકાગ્રતાની પ્રાપ્તિ થાય જ્યારે આવી એકાગ્રતાની સિદ્ધિવાળા ચિત્તથી શું કરવાનું છે? તે શું કહી શકે છે?

શ્રીધુદૂતોરબિજાતસયેવ મણેર્ચુલીતબ્રહ્મણ-
બાહેણુ તત્સ્થતદંજનતા સમાપત્તિ: ॥ ૪૧ ॥

ભાવાર્થ :- વૃત્તિઓ ક્ષીણુથઈ ગઈ છે જેની
તેવું ચિત્ત, આત્મામાં કે ઈન્દ્રિયોમાં કે વિપયોગમાં;
જેમાં પણ લગાડવામાં આવે તેમાં શુદ્ધ સ્ક્રિક
મણિની જેમ તદ્વિપ થઈને સમાધિસ્થ થઈ
જય છે.

વિસ્તાર :- જે ચિત્તની બૌતિક વૃત્તિઓ
ક્ષીણુથઈ ગઈ છે અને જેણે પરમાણુથી પરમ-
મહાત સુધી સ્થિર થવાનો કાળું પ્રાપ્ત કરી
લીધો છે તેવું ચિત્ત પછી “અલિજાતસ્યમણિ”
જેવું કામ આપે છે. જે ચિત્તની વૃત્તિઓ ક્ષીણુથઈ ગઈ છે એ ચિત્તને ચાહે અહીંતુ (પુરુષ-
આત્મા)માં લગાડો કે ચાહે બ્રહ્મણ(ઇન્દ્રિયો)માં
લગાડો કે ચાહે થાદ્ય (વિપયોગમાં લગાડો તો
તેમાં પણ લાગી જય છે અને તદ્વિપ થઈ જય
છે. અહીંતુ, બ્રહ્મણ અને થાદ્ય આ પારિભાપિક
શાખા છે. અહીંતુનો અર્થ થયો આત્મા, બ્રહ્મણ
એટલે ઇન્દ્રિયો અને થાદ્ય એટલે ઈન્દ્રિયોના
વિપયો.

આમ અહીંતુ, બ્રહ્મણ અને થાદ્ય એમ રણ
શાખા વાપર્યા. ચાહે તો ચિત્તને આત્મામાં
લગાડો તો તેમાં લાગી જય, ચાહે તો ઈન્દ્રિયોમાં
લગાડો રો. તેમાં પણ લાગી જય અને ચાહે તો
તેને ઇન્દ્રિયોના વિપયોગમાં લગાડો તો તેમાં
પણ લાગી જય.

સમાપત્તિ એટલે એકાશતા-સમાધિ. કહીએ
છીએ ને કે અસુક કાર્યમાં હું સમાધિસ્થ થઈ
ગયો હતો. એટલે કે એકાશ થઈ ગયો હતો.
તહંજનતા=તદ્વિપ. કેવું તદ્વિપપણું પ્રાપ્ત
કરી લે છે? “અલિજાતસ્ય”=અલિજાત,
નવજાત. જેમ અલિજાત શાખ છે તેમ નવજાત
શાખ પણ છે, જેમકે નવજાત શિશ્ય. તરતનું
જન્મેલું બાળક હોય તેને નવજાત કેમ કહીએ
છીએ? નવજાત - નહું જન્મેલું - પરમ પવિત્ર;

દ્રુતુધારી ૬૦

એ બાળક પરમપવિત્ર છે, શુદ્ધ
છે, તેનામાં હજુ કોઈ પણ પ્રકારનો
પદ્રોવિકારમાનો કોઈ વિકાર આવ્યો નથી.
આમ તો તે ગંધં છે. નવજાતશિશ્ય હજુ આરથી
લપેટાયેલું છે તેના ઉપર ચીકળા પદાર્થો લાગેલા
છે. આ જગ્યાએ ગંદકીની વાત નથી પરંતુ તે
કેવું નિર્વિકાર છે (?) તેની વાત છે, અને તેથી
જ તે નવજાત. આ જગ્યાએ અભિજાત=સંપૂર્ણ
શુદ્ધ, સંપૂર્ણ પવિત્ર. પણ શું અભિજાત છે?
મણિ. પરમ શુદ્ધ સ્ક્રિક મણિ પાસે જેવા
રંગનો પહાર્થ પડેલો હોય તે તેવા રંગનો
દૂખાય છે. રાતો, પીળો કે વાદળો; જેવો રંગ
મણિની આસપાસ હોય તેવા રંગનો મણિ લાગે
છે, તદ્વિપ લાગે છે. જે તે સ્ક્રિકમણિ ઉપર
ધૂળ કે કંચરો કે ધીજું કાંઈ આવરણ હોય તો
તેનામાં તેની સામેના રંગનું પ્રતિણિંબ પડતું
નથી. પ્રતિણિંબ પડે છે ત્યારે તો એમ જ લાગે
છે કે તેનો તે જ રંગ છે. અભિજાત મણિ બેટ્સે
કે શુદ્ધ મણિ - પારહર્શોક સ્ક્રિકમણિ. તેની પાસે
કોઈ પણ પહાર્થ મૂકવામાં આવે તો તે તેનામય
થઈ જય છે. કોઈ પણ વસ્તુ તેની પાસે મૂકવામાં
આવે તો તેનું તેમાં પ્રતિણિંબ પડે છે અને એ,
તે પહાર્થમય-પહાર્થથી તદ્વિપ થઈ જય છે.
એમ, પછી વિઘ્નોથી સુક્તા થઈ ગયેલું આગળ
બતાવેલા ઉપાયોગાંથી કોઈ પણ એક ઉપાયનો
આશરો લઈને જે મન એકાશતાની યોગ્યતા-
વાળું થયું છે, (એવી એકાશતા કે જે પરમ-
બ્રહ્માણુથી તે પરમમહાત્માનો કાળું કરી શકે છે.
એવું વશીકાર વાળું મન પછી આ બ્રહ્માણાંથી
જેમાં પણ સ્થિર કરવામાં આવે, જેમાં પણ
લગાડવામાં આવે તેમાં લાગી જય છે.
કેવી રીતે લાગી જય છે? આ અભિજાત
મણિ જેમ વિધવિધ રંગો સાથે અને વિધવિધ
રંગો જેમ અભિજાત મણિ સાથે તદ્વિપ થઈ
જય છે તેવી રીતે. એકાશ થયેલું મન આત્મા,
(અનુસંધાન પર મા પેજમાં)

ગુરુપૂર્ણિમાનો અહેવાલ

રાંકલન : મીના ચાલ

“દેર બેઠા ગંગા” એટથે જ શુકુપૂર્ણિમાનો દિવસ; સામાન્ય માનવી અને સંતનેના—શુકુજનો વર્ષયોના પ્રેમના આદાન-પ્રાદાનના દિવસ.

શિષ્ય માટે ન્યોગાવરીના દિવસ, તો મૂલ્યથી માટે શિષ્યને પારણવાના દિવસ.

આવાઈ પૂનમ અને તા. ૧૮-૭-૧૯૮૮ના દિવસ શુકુપૂર્ણિમા બિજવવા ઓમ પરિવારના ભાઈઓ કાગડોળો રાહ લોઈ રહેલાં, આમે પૂ. શ્રીના અંતરમ ભાવેને નીરખવા, તેમની વાક્યારાને સચોટ તથા સરળ રીતે પામવા માટે આ જ ઉત્તમ દિવસ હોય છે. શુકુજ તરફથી મળતાં આશોર્વંશનોને સ્વોત શુકુપૂર્ણિમાના દિવસે જ અવિરત વહેનો હોય છે અને તેને સમજવાની શક્તિ પણ પ્રાપ્ય અને છે. શ્રી રમેશભાઈ ત્રિયેતી કહે છે તેમ આઘ્યાતિભક્ત બાલમંહિરમાં હર શુકુપૂર્ણિમાથે એકેક ધોરણ આગળ વધવાનું હોય છે.

(૫૧ મા પેન્નું ચાલુ)

ઇન્દ્રિયા કે વિષયો; એ વણુમાંથી એમાં લગાણે તેમાં કોઈ પણ પરિશ્રમ વિના તેની સાથે તદૃષ્પ થઈ જાય છે, તેનામય થઈ જાય છે. કઈ રીતે? કોઈ પણ જાતના પરિશ્રમ કે પુરુષાર્થ વિના; કે આયાસ કે પ્રયાસ વિના. તેમાં તેને મહેનત કરવી પડતી નથી. જેમ આલાલામણિને રંગો સાથે તદૃષ્પ થવામાં કાંઈ પ્રયત્ન કરવો પડતો નથી તેમ કેળું મન ઉપર કાયું પ્રાપ્ત કરી લીધો છે તેવા મનને, ચિન્તને કાંઈ મહેનત કરવી પડતી નથી; તે ખિલકુલ સરળતાથી આત્મા, ઈન્દ્રિય, અને વિષય તે વણુમાંથી ગમે તેમાં તદૃષ્પ થઈ શકે છે. આહીંથી હવે સુમાર્ધની શરૂઆત થાય છે. કે આવતા અંકમાં ચચીંશું (ક્રમથઃ)

આ વર્ષે પણ શુકુપૂર્ણિમા ઉત્સવ બિજવવા માટે બધા ખૂબ જ ઉત્સાહી હતા. તા. ૧૭-૭-૮૬ ની સાંકે બધા ઈંગ્રેઝેનની વાડી મણીનગરમાં બેગા થયા. પૂ. શુકુદેવ અમદાવાડમાં હતા નહીં. સૌના મોઢામાંથી એક જ વાક્ય નીકળતું કે પૂ. શ્રી આવશે તો અરા ને? બધા જ આ વાક્ય બોલતા જરૂર હતા પણ તેમનું અંતર, તેમની શરીર કહેતી કે જરૂર શુકુદેવ આવશે જ, આપણને તેમના પ્રેમમાં તરણોળા કરશે જ.

સર્વે, ધર્મ, સ્ટેજ વગેરેની તૈયારી કરતા હતા ને સમાચાર આવ્યા કે શુકુદેવ અમદાવાડ આવી ગયા છે. બધા આનંદથી નાચી બિક્કા અને અમણ્ણા ઉત્સાહથી સલામંડપનું કાર્ય કરવા લાગી ગયા. ગંધા કામ પતાની, ખીંકે દિવસે વહેલી સવારે આવવા ઘેર ગયા.

પૂ. શ્રી શુકુદેવ ઉમરેડ હતા ત્યારે તેઓ શ્રીએ

“વીનાંગે શુકુએઓમ્ પરમાત્મા.

સહુ કોઈ ધનીએ દિવ્યાત્મા”

વિન્દયાંતિ માટેની અચૂક ધૂન આપેલી અને તે જ ધૂનની સંગીતમય કેસેની શુકુપૂર્ણિમાનો સવારનો કાર્યક્રમ શરૂ થયો.

પ્રણયવંદના કર્યા પછી ઉપરોક્ત જાપ એક કલાક સુદેહી બધાઓ આનંદ અને ઉમર્ગણી કર્યા, અરાધર આડ વાગે પૂ. શુકુદેવની પદ્મરામણી થઈ અને વાચિક જાપ પૂર્ણ કરી સ્વાધ્યાયની શરૂઆત કરી.

સૌના તન અને મન બાંને સાથે રાખી સ્વાધ્યાયનો પૂરેપૂરે લાભ લીધો. સ્વાધ્યાય માદ અલપાડાર પતાની ગંધા જ પૂ. શ્રીના પૂજન માટે હાજર થઈ ગયા. પૂ. શ્રીએ પૂજન પહેલાં જ

અતુમભરા

તेमनी हित्यवाणीने वैभवीमां वडाववा मांडी
अने कहुँ के...

“हरेक साल आपके शुद्धपूर्णिमा जन्मीये
छींचे तेनो अर्थ आप सी जाणो छो, पण आजे
आपके तेने जुती रीते जन्मीशु. आप सी
अमारा भाटे कंઈ ने कंई बेट-सोगाह लाव्या
होये ते तमारे अमारा प्रत्येनो प्रेम दर्शावे छे.
अमने पण तमारा प्रत्ये एटो. ज प्रेम छे, पण
आ वर्खते अमारी हळ्ठा छेवी छे के (सहुना
कान संबलणा तलपापड हे) ने कोई ने अमारु
पूजन करवुँ छोय के बेट-सोगाह मूळी डोय
तेना भाटे अमारी एक शरत छे, हरेक व्यक्तिने
कोई ने कोई कुटेव होय ज. तो अमारु पूजन
करवा आवनारे चोतानी कुटेवोमांथी एवी के
भीडी भीवी, तमारु आवी वरेह... तोक्ने छेडी
पहरो. अमे समल्ले छींचे के व्यसननां अध्या-
णीने आकुँ लाग्ये अने भनमां विचारशे पण
भरां के शुद्धलच्चे आ नवुँ तूत नाख्युँ पण
अमने तमारा प्रत्ये प्रेम दे; तमे जाते सुधरो
तो ठीक नहींतर अमारे आवा प्रयत्ने करवा
पहरो. अमे समल्ले छींचे के आ जश अधरु
हे, पण ने तमने अमारा प्रत्ये प्रेम डोय, जे
तमे सावेसाच शुद्धपूजन करवा हळ्ठता छो तो
आ कोई आशक्य नदी.

“अमे समल्ले छींचे के घण्यांनी हळ्ठा
पूजन करवानी होय पण चोतानी कुटेव छेडी
शके तेम न लाग्तुँ डोय तेओ. भाटे अमे भील
शरत मूळीचे छींचे के तेमले आपके के भंत्रनो
अप कोई तेवुँ सवालाअ भंत्रुँ अनुष्ठान करवुँ.
आ अनुष्ठान शेना भाटे हे ? हित्यात्मा जनवा
भाटे. आपके एकला भाटे नहीं सहुने भाटे हे.
सहु कोई भाटे आपके प्रभुने प्रार्थना कीशु
तेमां आपके आवी ज जवानां, आपण्यांची स्वाथी
न थवाय. आपके उद्देश्य तो साराय विश्वने
हित्यात्मा जनाववानें डोये लेईचे. आणो

केलुआरी-५०

२

सभाज सुधरशे तो आपके तो सुधरवानां ज.”

पू. श्रीनां उपरोक्त व्याख्याने सांखणी भाई-
बहेनांचे पू. श्रीना पूजन वर्खते चोतानी के के
कुटेवे छेडी ते जाहेर करी, एक भाई के के
भीडी छेडी नहोता शडता तेमले आनंदसंह भीडी
छेडवानुँ जाहेर कर्या, तो वणी भीज भाईचे
तमाकुनी उण्णी ज पू. श्रीना चरणोमां मूळी दृढीने
चोतानी संकल्प करी; तो बहेनांचे छींचणी,
कहा, तोक्नी वरेहे छेडी पू. श्रीना पूजनने
लाभ दीधी.

के भाई-बहेनो चोतानी कुटेव छेडी शके
तेम नहोतां तेमो “वीनवीचो....” ना जपनु
अनुष्ठान करवानुँ स्वीकारी पूजनमां आग लीधी;
तो वणी अमुळ भाईच्यो भाव नाशव्यु कही
चोताना भांड भनेअण उपर निश्चास नांगी
मेसी रथ्या.

पूजनविधि पत्या णाह पूज्यश्रीनी वाणीने
शाहदहेड आपती पुस्तिकाचो. “कडवुँ अमृत”
अने “धूश्वरनी शोणभ”नी विभायन
विधिनी शडआत थर्ह. “कडवुँ अमृत”
चोटवे ज कडवुँ सत्य. आ पुस्तिकानी विभायन
विधि पू. श्रीचे श्री नवीनभाई आपालाल सुण-
हिया अने तेमनां धर्मपत्नीना लाय करावी.
पू. श्रीना “प्रेरणाणिंह”मां आवता देणोमांना
केलाक देणोनो आमां समावेश थयो छे.
पू. श्रीचे कहुँ के-

“श्री नवीनभाईना परिवारे आमां आर्थिंक
व्ययनो लाभ लीधी छे एप्ले आपके तेमनी पासे
विभायन करावीचे छींचे तेवुँ नथी पण अरेषर
तेओ लायक छे. तेमतुँ आमुँ कुळुँण शुद्धमय
हे “शुद्ध ए ज परमेश्वर” तेवी साची समज-
वाणी तेमना धरनां अधां ज छे.”

पू. श्रीचे “कडवुँ अमृत” विशे योलतां
कहुँ के.

“तमारामांथी घण्यांचे अमारा देणो वांच्या
पृ

હોય છતાં તમને જણાવીએ કે સત્ય કહું હોય છતાં શુદ્ધજનોએ તેને કહેલું પડે છે. તમને ગમે કે ન ગમે અમને તેની ચિંતા નથી, અમને તો તમે સારા રસ્તો જાઓ, સાચી સમજણું પ્રાપ્ત કરો તેમાં જ રસ છે. અને એટલે અમે આ બધું તમને કહીએ છીએ. ઘણીવાર અમે અસુક વસ્તુ ડોઈકનો દાખલો હર્ષને કહીએ ત્યારે ધીજાં બધાં ખુશ થતાં હોય છે પણ તે વસ્તુ તમને પણ લાગુ પડતી હોય છે, જેનો દાખલો હીધે હોય તેને લાગુ ન પણ પડતી હોય. આપણે તો એમ જ સમજણો કે શુદ્ધ આપણુંને કંચાં કહે છી? એ તો ઇલાણુંને કહે છે. અમે કાંઈ ફરેકને જુહું જુહું નથી કહેવાના. અમને શું પડી હોય?

આ તમારા પ્રલે ભમતા છે. એટલે આટલું કહીએ છીએ. તમે સમજો જ નહિ અને “જ બિલ્લી મોભામોલ” કરો તો તેમાં અમારો શો વાંક? જેને સમજલું હોય તે સમજો?”

ત્યારણાં “ઈન્દ્રની બોળખ” પુસ્તકની વિમોચન વિધિ થઈ, જેનો લાલ ડૉ. શ્રીમતી મીનલગેન ડે. પેટે લીધો.

ત્યારણાં જી. શ્રી એ તેમની ઉપર આવેલા પત્રાનું વાંચન કર્યું, અનેક લાઈ બહેનોને વાંચ ઓછાઠી શુદ્ધપૂર્ણમાણે તેમને પ્રસારી આપી, આમ આપો કાર્યક્રમ જૂણ ઉત્સાહ, આનંદ અને સત્સંગથી ભરપૂર રહ્યો. કાર્યક્રમને અંતે સહુ પ્રસાદ લઈ વિદ્યાય થયાં.

ધૈર્ય પ્રાપ્ત કરવાના કાર્યમાં મંહત્તા આવે નહીં, કે સમજના પ્રયત્નમાં સુપદાઈએ નહીં અને લૌટિકતા સુખ્ય થાય તેવા મનોભાવ થાય નહીં તે માટે શું સુખ્ય સુખ્ય અને ગૌણું ગૌણું છે તેની સતત સાવધાનતા પ્રાપ્ત કરવાની સહિત ચોજના એટલે એમખરિવારનાં આધ્યાત્મિક ભિલનો-ઉત્સવો.

ત્રણે કાળમાં વર્તમાનકાળ જ સુખ્ય છે, વર્તમાનકાળ જ નખર અને મૂલ્યવાન છે. કેમકે વીતી ગયેલા વર્તમાનકાળને જ ભૂતકાળ કહેવામાં આવે છે અને આવનારા વર્તમાનકાળને જ ભવિષ્યકાળ કહેવામાં આવે છે. માટે વર્તમાનકાળનો યથાયોજ્ય ઉપયોગ કરી લેવો. જેઈએ. તેનું નામ જ “કર્મભાં કુશળતા.” વર્તમાન ચૂકી ગયો તે મહામૂલો મનુષ્યજન્મ ચૂકી ગયો.

સમૃદ્ધિ અને લૌટિક સુખો તો ધીજાં સાથનો દારા પણ મળી શકે છે પરંતુ શાંતિ તો સાચી સમજણું દારા જ પ્રાપ્ત થાય છે. સાચી સમજણું પ્રાપ્ત કરવા માટે જે કાંઈ મૂલ્ય આપવું પડે તે ગોધું જ છે.

પોતાના અહીંકારને પોપવાનો અને એછી મહેનતે વધુ પ્રાપ્ત કરવાનો લગભગ સૌનોં આથડ હોય છે. ભૂતકાળને પૂજવાનું, વર્તમાન-કાળનો નિરાદર-અલ્યાદર કરવાનું અને ભવિષ્યના તરંગી-અહુરંગી ખ્યાલોમાં રાચવાનું ઉપરોક્ત આથડમાંથી જ જન્મતું હોય છે.

—યોગલિંઘ

“મંત્ર - અલિપેટ - નિધિ” કે “પ્રભાતકેરી”

એ માંના એક નિયમ દ્વારા ગુરુપૂજન

(આમગુરુદેવજ્યંતીના પ્રેરણાદાયી અહેવાલ)

સંકલન : શુક્રપાઠ્યં

સંતશિરોમણી અને એભુ પરિવારના આરાધ્ય દેવ પુ. પુ. ગુરુદેવ શ્રી બોગલિકુલ મહારાજનો જન્મદિવસ એટલે જ આમગુરુદેવજ્યંતી.

તા. ૨૪-૧૦-૮૬ના રોજ અધ્યાત્મપ્રેરી-
એચે પૂજયશ્રીનો જન્મદિવસ “ધર્મમેઘ” મણિ-
નગર સુકુમાર જન્મયે. આજના કાર્યક્રમની
વિશેષતા એ હતી કે પૂજયશ્રીને આજના દિવસે
એકસહ વર્ષ પૂરાં થતાં હતાં. આને એભુ
જ્યંતીની સાથે સાથે ઈનામ વિતરણ દિવસ
પણ જાગવાયે.

કાર્યક્રમની શરૂઆત સ્વાધ્યાયથી ઉરવામાં
આવી. સુવેં ભાઈઓનોએ શાંતિથી ધ્યાનપૂર્વક
સ્વાધ્યાય કર્યો.

ઉદ્ઘોષક તરીકેની કામગીરી મને સાંપાચેલી
તેથી મેં સુભાને સંગોધતાં જણ્ણાંયું કે-

‘ગત વર્ષ’ દરમ્યાન આપણે સૌચે પૂજય-
શ્રીની વાણીને વધુમાં વધુ પ્રયારવા-પ્રસારવા
માટે કે કંઈ પ્રયત્નો કર્યો તે ખૂબ જ પ્રશંસની
છે; અને ગઈ સાલના આ કાર્યક્રમમાં અહેર
કર્યો સુજાર એચ. પ્રે. પુ. દ્રસ્ત વધુમાં વધુ કાર્ય-
ક્રમ ભાઈઓનોને કેટપ્રસારી આપણે.’

જાહીતા એડ્વોકેટ શ્રી પરમાનંદભાઈના
હસ્તે દ્રસ્તનાં જુદાં જુદાં કાર્યક્રોતોમાં અચ્છગણ્ય
કર્યો. હંસાયેન તથા ભાતુણેને અતુક્રમે
“કુતમ્ભરા”ના વધુમાં વધુ સક્યો. જનાવવાતું

સહર કાર્યોમાં અહેનોએ આગળ પડતો ભાગ
જાગવ્યો. હંસાયેન તથા ભાતુણેને અતુક્રમે
“કુતમ્ભરા”ના વધુમાં વધુ સક્યો. જનાવવાતું

તથા પ્રચાર-પ્રસારતું અગીરથ કાર્ય કર્યું. આ
અને બહેનો જ્યારે પ્રશંસાપત્ર લેવા માટે
પથાયીં ત્યારે પૂજયશ્રીનો જણ્ણાંયું કે —

“ અત્યારે એ બહેનોનાં નામ બોલાયાં પરંતુ
આ જગ્યાએ બાવન બહેનોનાં નામ બોલાયાં
હોત તો ! ? આ અને બહેનોએ કરેલા કાર્ય
ઉપરથી ધીમાં બહેનોએ પણ પ્રેરણ લેવા જેવી છે.

“ મહામના હંસાયેને “કુતમ્ભરા”ના બસો
પિસ્તાલીસ વાર્ષિક સભ્યો જનાયા. પંકુતભાઈએ
કલું કે એમણે (હંસાયેન) એમના પતિના સહ.
કારથી આ કાર્ય પાર પાડયું હશે પણ આપણે
એમ શા માટે માનીએ ? પતિના સહકાર વિના
જ તેમણે આ સક્યો જનાયા હોય !

“ આવાં કાર્યો સંપન્ન ઉરવામાં પત્નીને
પતિનો સહકાર ભલે ના હોય પરંતુ વિરોધ
ના હોવો જેઈએ. આપણુંને શ્રદ્ધા છે જ કે
આ કાર્યમાં જે પતિ-પત્નીએ લાગેલાં છે
તેમનામાં પરસ્પર વિરોધ નથી જ. અનેને
એકણીજનોને સહકાર મળે તો તે ખૂબ આન-
દની વાત છે પણ સહકાર ન મળે તો આવાં
કાર્યો શું ન થઈ શકે ? બહેનો દ્વારા કેટલી મોટી
સંસ્થાએ યાલે છે ને એ સંસ્થાએ દ્વારા કેટલાં
મોટાં કાર્યો થાય છે !

“ નવરાત્રીમાં ગરણા ગાવામાં આપણે કેટલા
ઉન્નગરા કરીએ છીએ ? ! દરેક તહેવારોમાં
સ્વરૂપ શીતે આપણે કેટલાં સર્કાર રહીએ છીએ !
પરંતુ સ્વરૂપતામાંથી સુક્રમતાના ઉપલા પગથિયે
ચલું છે કે નહીં ? આપણે આપણી જુદ્ધિને
યોડી વધુ વિકસિત થવા હેવી છે કે નહીં ? જો

હંસાણે રઘુ સભ્યો કર્યા તો આપણે થા
માટે વહુ સભ્યો ન બનાવીએ?

“આપણે કથા મેસાડીઓ, સત્ત્વાંગ મેસાડીઓ,
દાન-પુરુષ કરીએ; એ બહુ કલ્યાણકારી જ છે,
પરંતુ સત્ત્વાધિત્યના પ્રચાર-પ્રસારનું આ કાર્ય
વધુ કલ્યાણકારી છે. આપણે હરહંમેશ કણીઓ
છીએ કે પાણીની પરબ, શેરડીના રસાની પરબ,
છાશની પરબ વળેરે પરબ ઉપયોગી છે પણ
એ બધી પરણો મેસાડવાની પ્રેરણા કે પરબમાંથી
મળે છે તેની ઉપયોગિતા કેટલી? ! અના દ્વારા થતું
જાનદાન કેટલું મહત્વનું! ! તો જે સત્ત્વાધિ-
યમાં આવાં કલ્યાણકારી કાર્યોની પ્રેરણા આપેલી
હોય તે ખૂબ જાંચામાં છાંચી પરણ છે. આવી
પરણો મેસાડી, બાવું જાનકૃપી અમૃત તરફથા
છુયેને પિવડાની રહ્યાં છે તેવાં ભાઈ-
બહેનોને અત્યારે પ્રથમાં પત્ર અને ઈનામો
આપાઈ રહ્યાં છે. અસ્તુ.

“પંકજભાઈ એ હમણાં કેસેટ દ્વારા પ્રચાર-
પ્રસારની વાત કરી એટલે ગામને એક વાત ચાહ
આવી ગઈ. થોડા સમય પહેલાં અમે આણુ ગયા
હતા. ત્યાં લગભગ હોઢેક માસ રોકાયેલા.

“અમે આણુ હતા ત્યારે ત્યાં સંત્સુભેદન
બરાયેલું. સંભેદનમાં એક આધ્યાત્મિક મંળના
ભાઈ એ અમના શુકુળની કેસેનો સેટ લાવેલા.
શુકુળના હાથે જ એ સેટનું વિમોચન થયું.
એ મંળના શુકુળએ કેસેનો સેટ વધુચાર
ભાઈ એને આપ્યો. એક ભાઈને કેસેટો આપતાં
કહ્યું કે ‘એ કેસેટ અલમારીમે’ રખનેકે [લખો
નહીં હૈ, આપકી માલિકીની લી નહીં હૈ. એ
સારે કેન્દ્રકે લિયો હૈ. કેન્દ્રમેં બાળના, કેન્દ્રમેં
સુનના. લોકિન પાન કે ગંગે પે મત બળના.’]
અસ્તુ.

“આજ સુધી તો મારી હડ હતી એટલે
હું તમને કેસેટ બનાવવાની ના પાડો હતો.
પરંતુ તમારા સૌનો અતિ આગડ અને મને પણ

૫૬

ધીમે ધીમે લાગવા માંડયું કે વાંચવામાં તમને
સૌને કંદળો આવે, એના ડરતાં કેસેટ સારી.
એટલે કેસેટ બનાવવાની અમે હા પાડી. પરંતુ
હવે કેસેટ બની એટલે તેનો ઉપયોગ ગમે ત્યાં
કરવાનો નથી. આ કેસેનો ગમે ત્યાં ઉપયોગ
કરીએ એનો અર્થ એ જ કે કેસેટમાંના સત્ત-
સાહિત્યની ડિમત હજુ આપણે સમજ્યા નથી.
કે તેનો ઉપયોગ કચાં કરવો તેનો આપણને
ખ્યાલ નથી.”

છેદ્વાં ગણેક વર્ષથી પ. મુ. શુકુદેવ શ્રી
ગોગલિલું ઓમજયંતી અને શુકુપૂર્વિમાના
હિવસે કેને શુકુપૂર્જન કરવું હોય તેવાં ભાઈ-
બહેનોના પાંચ કોઈ ન વત લેવડાવે છે.
કાંતો પોતાના ચરણોમાં કેટ જ નથી મૂકવા દેતા
અથવા તો જે લોકો વત વે તેમને જ કેટ
મૂકવા દેતા હોય છે. અને પૂજયથી વત પણ
કેવાં લેવડાવે છે! જે લોકો વત વે અને પ્રમા-
ણિકૃતાથી તેતું પાલન કરે તેને શારીરિક તથા
માનસિક અને કચારેક આર્થિક લાભ પણ થાય
છે. સાચે જ પૂજયથી દ્વારા લેવાયેલ આ નિર્ણય
ખૂબ કાંતિકારી છે.

આજના હિવસે પણ પૂજયથીએ અહેર કહ્યું
કે, “આજના હિવસે કેમણે શુકુપૂર્જન કરવું
હોય, શુકુપૂર્જનને લાભ લેવાની ઈજ્જ્ઞા હોય
તેણે આ રીતે શુકુપૂર્જન કરવાનું છે—

“દરેકે પોતાના ઘરમાં ‘મંત્ર અભિપ્રેક-
નિધિ-પાત્ર’ રાખવાનું. એક આસન પર મેસી
સામે એક ઝિપિયો મૂકવાનો. ત્યાર જાહ પાચત્રી
મંત્રની એક માળા કરવાની, માળા પૂરી થાય ત્યારે
સાથે રાખેલા પાત્રમાં તે ઝિપિયો નાખવાનો. એનું
નામ ‘મંત્ર-અભિપ્રેક-નિધિ.’” આવતી ઓમ-
જ્યાંતી સુધી દરશાજ આ પ્રમાણે કરવાનું
નિધિપાત્રમાં કે નિધિ એકડો થાય તે તમારો
નહીં. તેનો જે ઉપયોગ થવાનો હશે તે થશે.
તમારી તો મંત્રનિધિ. કોઈની શક્તિ ન હોય તો

ગુલમખા

તે એક રૂપિયાથી ઓછા પૈસા પણ મૂડી શકે. પરંતુ સામાન્ય રીતે એક રૂપિયા અને એક માળા. એકથી વધુ રૂપિયા મૂડવા હોય તો મૂડી શકાય, પરંતુ કેટલા રૂપિયા તેટલી માળા કરવાની માળા, આખા વર્ષો દરમયાન નિયમિત કરવાની.

“કેમની ઉપરોક્ત વત દેવાની હૃદા ના હોય તેમના માટે બીજે એક નિયમ જે શક્તય હોય તો આ શિયાળામાં પ્રભાતંહરી, પ્રભાતહરી માટે ગોછામાં ગોછાં પાંચ બાઈ-ણણેનો સવારે પથી દ દરમયાન પોતપોતાના વિસ્તારમાં, મંત્ર મોલતાં મોલતાં તાળીઓ પાડતાં પાડતાં, વાજની વગાડતાં વગાડતાં ફેરીમાં ફેરે અને એક કલાકમાં જ્યાથી નીકળ્યાં હોય ત્યાં આવી જાય. પ્રભાત ફેરીમાં એક વર્ષત ગાયત્રીમંત્ર (સંગીતમય) માલવાનો અને એક વર્ષત સ્તીકરમાં વર્ષયો છે તે—

કર્મ કરેંગે જેસે ક્રિદ બોગેં નેસે.

કર્મ કરેંગે જેસે વેસે

ક્રિદ બોગેં નેસે નેસે.

“ઉપરોક્ત મંત્ર મોલતાં જવાનું. એક વર્ષત ગાયત્રી મંત્ર અને એક વર્ષત આ ગુજરાતી મંત્ર માલવાનારને અને સાંભળનારને પણ અખર પડે, સમજું પડે તે રીતે માલવાનો. ગુજરાતી મંત્રને સંપુર્ણ ગાયત્રીમંત્રનો. કે સાંભળે તે વિચાર કરે કે જેવાં કર્મ કરીશું, તેવાં ઇણ ભગદો. આપણે આજ હન સુધી સહ્યારોના પ્રચાર અને પ્રસારનું કે કાઈ કાઈ ફરી શકયા છીએ તેનાથી અનેક ગણું કાર્ય આ પ્રભાતહરી દ્વારા થઈ શકયો. અને જે દાડો પ્રભાતહરીમાં ભાગ હેઠે તેને પણ કેટલો અધે લાલ થશે ? !”

મણવા છતાંથી કિંમતી અને મહત્વનું હોય તે તેવું જ લાગશું જેઠીઓ. કષ્ટથી પ્રાપ્ત થનાર પણ જે અકલ્યાણુકારી હોય તો તે તેવું જ જણાશું જેઠીઓ. તેનું નામ જ “વાસ્તવફરીંપણું.”

—યોગબિલ્લુ

“શિયાળાના ચાર મહિના રોજ સવારે પ્રાણમુડૂર્તામાં ડાડવાનું અને પ્રભાતહરીમાં જેવાનું. આવો નિયમ રાજ્યો. હોય તેથી વહેલાં જીઠી પણ જવાય અને એક કલાક પ્રાતઃધર્મણુનો લાલ પણ મળે પ્રાણમુડૂર્તા દરમયાન શુદ્ધ પ્રાણનો-પ્રાણવાયુનો લાલ પણ મળે, વળી એક લથથી મંત્રોવચાર કરતાં હોઈ એ તેથી આ વાચિક જાપ દ્વારા ભસ્તા પ્રાણન્યાયામનો લાલ પણ અનાયાસે જ મળી જાય. આ વાચિક જાપ દરમયાન શરીરનો અશુદ્ધ વાયુ બાંડાર નીકળે અને વાતાવરણુંમાનો શુદ્ધ પ્રાણવાયુ શરીરમાં જાય. વળી આ પ્રભાતહરી દ્વારા ભરજન પણ થાય, ગુરુજીનું કામ પણ થાય અને વિશ્વકર્માણું પણ કામ થાય.

“તો, આજના હિવસનું શુકુપૂજન આ— “મંત્ર-અલિપેક-નિધિ” અને “પ્રભાતહરી”— ના નિયમો લઈ ને કરવાનું છે, આપ સૌ તે અંગે વિચારને આપનો નિર્ણય આજથી પાંચ હિવસ બાદ એટલે કે બેસતા વર્ષના હિવસે આપણા સ્વયંસેવકલાઈ અને જણાવી દેશો, જેથી તેચેને જ્યાલ આવે કે કેટલા વિસ્તારોમાં પ્રભાતહરી નીકળી રહી છે અને તેમાં કેટલાં માણુસો જોડાયાં છે. અસ્તુ.”

પૂજયશ્રીના પ્રવયનની સમાપ્તિ બાદ શુકુપૂજને પ્રસાદ દેવા જેડાં. પ્રસાદ લીધા બાદ સૌ લાઈણણેનો આજના નિયમો વિષે વર્ચી કરતાં છૂટાં પડ્યાં. દરેકની વર્ચી ઉપરથી એમ લાગતું હતું કે લગભગ બધાંએ આ જેમાંથી એક સત દેવાનું વિચારેલું, કેટલાક તે બેચેની નિયમ દેવાનાં ડરસાડી જણ્યાતાં હતાં.

વિના પ્રયત્ને ગ્રાહિત !!!

આપણે વિવેકાંધ થઈ ગયા છીએ

સંક્લન : સદગુરુસમર્પણભિસુ

ઓમભરિવારના ઉપછેતા, ૩૦-૧૦-૮૬ના રોજ જેસતા વર્ષના દિવસે “સ્વાધ્યાય સત્ત્વંગ ભિલન” ને કાર્યક્રમ ચોલ્યો. નવા વર્ષનો પ્રારંભ સ્વાધ્યાય અને સત્ત્વંગ દ્વારા થાય એ કાંઈ નાનેસુનો લાલ નથી અને તેથી જ તો લગભગ આપો ઓમભરિવાર જેસતા વર્ષની વહેલી સવારે “ધર્મભેદ” માં એકટો થાય છે, સ્વાધ્યાય સત્ત્વંગનો લાલ વે છે; પ. પૂ. શુકુરેવ શ્રી ચોગભિલુણાં હર્ષનનો લાલ વે છે, ઓમભરિવારના સ્વજનોને મળવાનો લાલ વે છે અને ત્યારથાં જ સૌ પોતપોતાના ચાંગત કાર્યક્રમમાં લાગી જાય છે.

સવારે સાત વાગ્યે સ્વાધ્યાયનો પ્રારંભ થયો. સ્વાધ્યાય બાદ પૂજયશ્રીને આર્થીન્દ્રયનનો પ્રારંભ કર્યો. ઓમશુકુરેવજ્યંતીની વાતરું અનુસંધાન મેળવતાં પૂજયશ્રીને જાળ્યાંનું કે-

“ઓમશુકુરેવ જ્યંતીના દિવસે શુકુપૂજન કયા પ્રકારે કરવાનું છે એ વાત તે દિવસે થઈ ગઈ. મંત્રઅભિપેકનાધાયના તો પ્રભાતદીમાં કરવાનો નિયમ લઈ રોજેરોજ શુકુપૂજનનો લાલ લવો. આ પ્રકારના નિયમનું પાલન કરતી વખતે લાલના એવી રાખવાની છે કે તે લમયે તમે શુકુપૂજન જ કરી રહ્યા છો. ઓમશુકુરેવ જ્યંતીના દિવસે શુકુપૂજન કથું હોત તો તનો લાલ એક જ દિવસમણત પર તુ આ તો નિયમનું શુકુપૂજન! આપણું શુકુપ્રેમાભક્તુણું કહેતા હતા કે ‘બાધુ! કાયમ જ શુકુપૂજું’મા હોય તો કેવો આનંદ થાય!?’ તો આ વખતે આપણે નિયમ લેવાય્યો, કેના પાલન દ્વારા

આપણે આપા વર્ષ સુધી, રોજે રોજ શુકુપૂજનનો લાલ સાચા અર્થમાં લઈ શક્યો.

“તે દિવસે તમને શુકુરેવના ચરણોમાં દ્રોય મૂકૃવાની પણ ના પાડી હતી. દ્રોય મૂકૃતું હોય તો કથાં મૂકૃવાનું? મંત્રઅભિપેકનિધિયાત્રમાં આ પાત્રમાં દ્રોય મૂકૃતી વખતે રોજ ગાયત્રી મંત્રની એક માળા કરવાની તમારા સૌનો અધિકાર ઇકત એ માળા ઉપર, નિધિયાત્રમાં કે રકમ એકટો થાય તેના ઉપર તમારો અધિકાર નહીં.”

“ઉપરોક્ત સંક્ષિપ્ત કરવામાં તે દિવસે લગભગ સૌએ પોતાનો હાથ જાંચા કરી પોતાની સંમતિ હર્થાવી હતી. તો આજે સ્વયંસેવક લાઈ-બહેન પાસે સૌ પોતપોતાનાં નામ લખાવી હે. આપા વર્ષ સુધી તે સૌના નામની નોંધ પરાબર રાખવાની છે. વર્ષ દરમ્યાન કે નિધિ એકટો થથે તેનો ઉપયોગ પરમાત્મા પ્રેરણું કરે તે સુજાણ કરવામાં આવશે.

“ઓઝે સંક્ષિપ્ત પ્રાતઃક્રિયાનો લેવાનો હતો. શિથાળાના ચાર મહિના, ઓછામાં ઓછા પાંચ માણસ સાથે જુદા જુદા વિસ્તારમાં પ્રભાતઃક્રિયાદાઢવાની, એક કલાક સુધી વાચિક મંત્રનાય કરતાં કરતાં જુદા જુદા વિસ્તારમાં કરવાનું. જ્યાથી શિસ્તપૂર્વક પ્રાતઃક્રિયામાં ભાગ લેવાનો અને ફરી દરમ્યાન જ્યોતિસંહનશક્તિથી કામ લેવાનું. કેટલાક લોકોને આ કાર્યક્રમની મહત્ત્વાની ન હોય, તેમની જાંધ બાળદી એમ તેમને લાગતું હોય અને તેથી આ કાર્યક્રમનો વિરોધ પણ કરે. આ બધી જ સુશકેલીઓને સંહન કરીને આપણું કાર્ય કરવાનું છે.

“આપણા ખિસ્તામાં પૈસાની કબી ના હોય તો આપણે પૈસા તો અચી' નાઓએ પરંતુ આ તો ધનતું નહીં, તનતું અને મનતું કામ છે, આપણે અવારનવાર કહીએ છીએ કે તન, મન અને ધન; ગણેનો સદ્ગુપ્તોગ કરવાનો છે.

“કિરીટાઈ (શુરૂલુના પ્રેરી) કથમ કહેતા કે ‘ગુરુણ ! ધનનો સદ્ગુપ્તોગ કરાવે એવા આપના જેવા મહાપુરુષો અત્યારે છે કંઈ ? દર વર્ષે અમે કુદુંણ સાથે એક ચા ગોળ સ્થળે કરવા નીકળી જઈએ છીએ. થોડા દિવસ હરી-દરી, પચીસ-પચાસ હજાર ડિફિયા અચીને પાછાં આવી જઈએ છીએ. પણ ત્યાં કહીએ છીએ શું ? કે અહીં કરતા હતા તે ત્યાં કર્યું. ત્યાં મોજમજ કરી અને થોડા દિવસ બાદ પાછા આવી ગયા ! મહા પરિશ્રમે પ્રાપ્ત કરેલા ધનનો સદ્ગુપ્ત્યન્ય ના કર્યો. તે ધનનો સારો અને સાચો ઉપરોગ તો ગુરુદેવ, આપ જ કરાવો છો.’ અસ્તુ.

“તો આમ, ગુરોજનો દ્વારા અપાયેલા આવા વતોનું પાલન કરીને આપણે તન, મન અને ધનનો સદ્ગુપ્ત્યન્ય કરવો જોઈએ. અસ્તુ.

“મનુષ્ય મનની એ કેવી અભરદસ્ત કમનેરી છે કે એ હંમેશાં યમતકારને ધરશે છે. એને કમનેરી જ કહી શકાય. યમતકારની પાછળ અગ્રગઠિપેંકઈ ભાવના રહેલી છે ? આ ભાવના-ઓછામાં ઓછી મહેનતે અથવા સાવ વગર મહેનતે વધુમાં વધુ પ્રાપ્તિ. આ તો થઈ સામાન્ય મનુષ્યની યમતકાર વિશેની ભાવના.

“ઓમ્પરિવારમાં આપણે યમતકાર શાને કહીએ છીએ ? એની વ્યાખ્યા શું કરીએ છીએ ? ચ-મત-કર - યમતકાર મત કર. કેમ કે એવા યમતકારે થતા જ નથી. યમતકાર એ તો આપણું મનની ભરમણ્ણ છે, આપણા મનની કમનેરી છે; ઓછી મહેનતે - વગર મહેનતે વધુમાં વધુ પ્રાપ્ત કરવાની એક વૃત્તિ છે. અને તેથી આપણી વિચ-

કણુદ્ધ ભાદી જાય છે, આપણે વિવેક બ્રહ્મ થઈ જાય છે, બીજી ઘણી બધી જગ્યાએ સાવ આંધળા થઈ જઈ એ છીએ.

“ચમતકાર જેવો જ હોય તો વિવેકદ્વારી અંગોથી જુઓ. આપણા ઇંવાડે ઇંવાડે ચમતકાર છે. આપણું શરીર-પિંડ અને આપણું વિશ્વ-પ્રાણાંડ એ પણ એક મોટો જાબરહસ્ત ચમતકાર છે. આ પૃથ્વી, ધર્મ, મારી, દેશ, પત્થર, પર્વત, સમુદ્ર વગેરે જાખું જ ચમતકાર છે. આ પૃથ્વી-તેમાં કેવાં કેવાં બીજી વાવીએ છીએ અને એ બીજમાંથી બીજાં કેવાં વૃક્ષો, કેવાં કેવાં ફેલો, કેવાં કેવાં રંગાની આપણું પ્રાપ્તિ થાય છે!!! આ કેટલો મોટો ચમતકાર કહેવાય !

“તો આમ હરસ્થને-હરસમ આપણી આસપાસમાં ચમતકાર જ જાની રહ્યા છે. આ શરીર અને આ શરીરમાંથી પાછું એવું બીજું શરીર પ્રગતે એ કેટલો મોટો ચમતકાર ! આ હરતું-હરતું શરીર, એ શરીરનાં એ જો અને અવયવો, શરીરની અંદર મગજની રચના ! આખુનિક શોધી કે એને આપણે ચમતકાર કહીએ છીએ પરંતુ એ શોધીના રચયિતા કોણ ? આપણે, આપણું મગજ.

“આપણી મંદશુદ્ધિના કારણે આપણે કહી આવા સુંદર વિચારે કરતા નથી. આપણે ચમતકાર દ્વારા શું ધરચીએ છીએ ? કે કોઈ આપણા માયે હાથ મૂકી હે, કોઈ આપણું આશીર્વાહ આપી હે અને આપણું અધિકાર પ્રાપ્ત કર્યો વિના ધરચિછત વસ્તુ મળી જાય; આપણે જોકું કરતા રહીએ, આપણે અનીતિના માર્ગે જઈ એ અને ધરચીએ કે ગુરુણ આપણું આશીર્વાહ આપી હે અને આપણું કલ્યાણ થઈ જાય, ગુરુણ આપણા માયે હાથ મૂકી હે અને આપણે બધાંય પાપોમાંથી મુક્ત થઈ જઈ એ.

“આન વિચારે એ આપણી યુદ્ધિની મંદતા છે, આપણા વિવેકની બ્રહ્મતા છે. આ રીતે જીવન જીવનથી સુખશાંતિ કંચાં મળવાનાં હતાં ? ! આ

तीरे तो आपके हेरान थहरू, आपणी आस-
पासनांने पण हेरान करीशु, वे सदाचारभय
लवन ल्ये छे तेमने पण मुरकेलीमां भूळी थहरू.
क्यारे ? के ज्यारे आपा रस्ते जहरू, यमत्कारने
निहाणवा भाटे आंधारा थहरू जहरू, वगर महेनने
पैसा प्राप्त करवा भाटे न करवानु करीशु,
पैसाने सर्वस्व मानीशु, पैसाने एटलु वधु
महरव आपीशु—द्रव्यने एटली बधी महतां
आपी थहरू के लेशी आपणे विवेकभ्रष्ट थहरू
कर्त्तव्य, सारासारनु आपणने लान पण न रहे,
ओ पण अवर न पडे के डपिया, पैसा, मोटर,
गाडी, महेल वर्गे वधांनी शु किंभत छे ? आपण
स्वमान न होय, आपणी तंहरस्ती ले
सारी ना होय तो मोटर, महेले,
सोनाइपानां अठणक घरेखांचो; ओ वधांनी शु
किंभत छे ? ! कांड ज नहीं. चेताने
लेई के टेलु?

सांई उतना दीज्जेये, जे मे इकूंभ समाय,
जी भी भूखा न रहु, साडु न भूखा जाय.

“आवी वातो आपके सतत संबंधाता
रहीचे, वर्षी सुधी शुरुसंतोना चरणामां रहीचे
अने छतांय आवी वातो एक कानमांथी ठीक
कान सोंसरी नीकणी जाय, आपणा हृदयमां
चाटे नहीं, आपणा लवनमां जितरे नहीं तो
शुकुसंतोना इक्त माये हाय भूक्तवामान्थी आपणे
सुभी नहीं थहरू जहरू.

“आ वधी वातो खण समजवानी छे.
शुरुसंतो पासेथी आपणे वे कांड उपकेश सांभ-
णीचे छीचे तेने वधुमां वधु आपणा लवनमां
उतारवाने। प्रयत्न करवाने। छे, आपणे सुगंधी
पुण्य बनवानु छे, सुगंधी पुण्य बनीशु तो
बगवानना दृत पवनदेव आपणी जी सुगंधने
यारे बाबु प्रसरावशी, आपणे ओ सुगंध प्रसा-
रवानी के प्रचारवानी आवश्यक्ता नहीं पडे.
आपणे तो इक्त शेने। प्रयत्न करवाने। छे ?

सुगंधी पुण्य बनवानो। आपौ यम, नियम
अने सदाचारे प्रभावे वतीने, आपणा लुपनने
नियमित राखवानु, आपणी तंहरस्तीने वधुमां
वधु साचववाने। प्रयत्न करवाना छे.

“येक तंहरस्ती लाख नियामत” ले तंह-
रस्ती सारी नथी तो तमाचे तमाम वस्तुओ
धूण बराबर छे. याचा ज्यारे सारामां सारी
वस्तुओ आतां हो त्यारे आपणे पहचा पहचा
जेता थहरू. केम ? के भने ठायाणिटिस छे, के
भने टेन्सर छे, के भने टी. बी. छे, के भने
आ छे, के भने ते छे.

“जमे तेटका प्रयत्न करीशु” तो पण सामा-
न्य देण तो आववाना ज छे. परंतु लेनाथी
आपणी तंहरस्ती जाय एम छे, लेनाथी आपणा
धर्म जाय एम छे ओ वधी वस्तु हेणीती रीते
आपणाथी केम थाय ? जाणी लेईने आपणाथी
केम थाय ? जाणी लेईने आपणाथी धर्मभ्रष्ट
केम थाय ? तंहरस्तीना नियमोना लोग केम
आपाय ? तंहरस्तीना लोगे पैसा केम कमावाय ?
पैसाने आटले बधी मोह शा भाटे ? आपणे
साव भूरभ छीचे ? हा, भूरभ ज छीचे त्यारे
तो पैसाने आटले बधी मोह थये ने ?

“आपणी प्रतिधाना लोगे, आपणी तंहर-
स्तीना लोगे, आपणा कुटुंबना लोगे, आपणा
शुरुसंतोनी प्रतिधाना लोगे आपणे न करवानु
करीचे छीचे अने पछी हेरान-हेरान. आपणे तो
हेरान पण आपणी आसपासनां तमाम हेरान !
आपणां भातापिता, आपणा भित्रो, आपणी
पत्नी, आपणा पाति, आपणां पाडेशी, आपणां
स्नेहीप्रेमीच्या-ज्ञे वधाने नीचु लेवापण्य. वणी
वधाने नीचु लेवापण्य ओहु डोय तेम आपणी
तंहरस्ती पण जाय.

“आसुर्वेदने येक जणरदस्त सिद्धांत छे के
तमे आरोग्यना नियमोना लांग करीने ठीमार
पहचा होशा के जेहु खावारीवामां आवी गयुः

હથે અને ધીમાર પડયા હથો તો તેના માટે આખુરેદમાં દવા છે, પરંતુ તમે અધરમાં કર્યો હથો કે તમે ગોડું કર્મ કર્યું હથો અને એના બહલામાં, એના દંડિપે તમને કે સુણ થશે તેની દવા કોઈ પણ નથી. એ દર્દનું કોઈપણ દવાથી, કોઈ પણ જરીણુંદોથી શરીરન થવાનું નથી; એ તો કોણવલું જ પહોંચો. આ નિયમ આપણે ન અખૂતાં હોઈ એ તો આને જાણીએ, આને સાંભળીએ. આમ તો વર્ષોથી આતું બધું આપણે જાંબળી રહ્યાં છીએ પણ તેના અમલ કચારે કરીશું?

“આ બેસતા વર્ષના દિવસે અત્યારે કટાકડાએના અવાજથી વાતાવરણ ધમધમી રહ્યું છે. એ અવાજની ઉપરવટ થઈને અમે અવાજ કાઢી રહ્યા છીએ, તમને સૌને સાંભળાવી રહ્યા છીએ. શા માટે? કારણુંકે તમે અમારાં આત્મીય છો અને અમે તમારા આત્મીય છીએ. તમે આ શરીરમાં મારાપણુંને ભાગ રાખો છો તેથી અમને આવી બધી રહસ્યની વાતો કહેવાનો ઉમળકો થાય છે. કચારેક આવી વાતો તમને ગમતી હથો. કચારેક નહીં પણ ગમતી હોય, પરંતુ આ કર્તૃ અમૃત - કર્તૃની દવા કોણ પિવડાવે? એ તો એ પોતાનાં હથો તે જ પિવડાવશો, બાકી અણપામણાં કોણ થાય? શા માટે અળખામણાં થાય? સાચી વાત તો સંતો જ કહે, વડીલો જ કહે, આપણાં હિંનેપીએ જ કહે. એ પરવા ન કરે કે અને ગોડું લાગશો, આને મારા તરફ તિરસ્કાર આવશે અને પછી નહીં આવે. ન આવે તો હરિધિંદ્ધા, મારા તરફ તિરસ્કાર થતો હોય તો લલે થાય પણ મારે તો એને આને સાચી વાત કહેવાની જ છે. એનો ભાવ લો મારામાં છે તો મારે મારું કરાય બાળવલું પડે એમ માની સંતો સાચી વાતો કહે છે. અદ્દતુ.

“તો, મૂળ વાત ચાલતી હતી ‘મંત્રઅભિપ્રેક
ફેલુંથાસી-૬૦

નિધિ’ અને પ્રભાતેદ્વારીની. એથે જેણે આ કાર્યમાં લેડાવાનો સંકદ્ય કર્યો હોય તે સૌ પોતાનાં નામ લખાવી હે, કેથી અમારી જાણુમાં રહે. આ હોઠ મહિના સુધી ગમે આખુમાં રહ્યા અને હવે પાછા ગમે ત્યારે એ ખાજુ જિપડી જર્દાએ અને કચારેય પાછા આવીએ. પણ અમારી પણ નામ હોય તો અમે જ્યાં હોઈ એ ત્યાં અમે એ વાતનો વિચાર કરતા રહીએ, ત્યાથી આદેશ આપતા રહીએ કે કોણ શું કરવાનું છે, કેમ કરવાનું છે, કેની રીતે કરવાનું છે? અમારું આહી જ રહેવાનું નક્કી નથી હોતું. આને અહીં છીએ તો ડાંબે સવારે બહારગામ જિપડી જર્દાએ. અને બહારગામ જર્દાએ તો પાછા કચારેય આવીએ?

“ધણું દિવસે સુધી સતત તમારા સંપર્કમાં રહ્યા છીએ. તમને સતત કાંઈને કાંઈ જાનરૂપી બાધું આપતાં રહ્યા છીએ. હવે થાડો સમય અમે પણ અમારું કાંઈક કરીએ, અમારું રૂહનું બાધું જાંધીએ. અમને પણ ઈચ્છા થાય કે થોડા દિવસ શાંતિમાં, એકાંતમાં રહીએ. શરીર, શરીરનું કામ કરે, શરીર જ્યારે વૃદ્ધ થવા લાગે ત્યારે વધુ કામ ન કરી શકે, એને પણ શાંતિ નેર્ધતી હોય. અને તેથી જ અમે હોઠ મારીને મારીન્ટ આખુ રહ્યા ત્યારે સંખ્યત આશા કરેલી, આદેશ આપેલો કે અમારી રજ સિવાય કોઈ ત્યાં ના આવે. ધણું બધાં ત્યાં આવવા માટે તૈવાર હતાં. અને ત્યાં તમામ પ્રકારની સંગૃહ પણ હતી. પરંતુ તમે સૌ ત્યાં આવો એટલે તમારું ધ્યાન રાખવામાં અમારો બધી કાંઈકમ જોરાંથે પડી જય. અસ્તુ

“આને એ સુખ્ય વાત કરી એનું ગરાબર રસ્યુ કરવાનું છે, રસ્યુ કરીને બરાબર જીવનમાં ઉત્તારવાનું છે. આપણે અતિ પ્રચલિત એવા વાદમીક ઋપિની વાત અવારનવાર કહીએ છીએ. તેઓ ઋપિ જન્યા તે પહેલાં વાલીયા લુંટારા તરીકેનું જીવન જીવતા. પરંતુ એક સંત દારા તેમને અગર પડી કે તે એ પાય કરી રહ્યા છે

અને તે દ્વારા એકડા થયેલ ધનનો ઉપયોગ પોતાના કુટુંબના ભરણુંપોષણ માટે કરી રહ્યા છે તે પાપમાં તેમના કુટુંભીજનોએ લાગ્યોડાર નહીં થાય. તેમના કુટુંભીજનોએ તેમને કલું હતું કે ‘સહાચારથી; પુષ્ટયના આચરણથી કમાવાના પુષ્ટકળ રહ્યાએ છે. એ રહ્યા દ્વારા ધન લાવ અને અમને ખવડાલ. અમે તને પાપાચરણ કર વાતું નથી કહેતા. તેથી અમે તારા પાપમાં લાગ્યોડાર નહીં. અને કદાચ માની લઈએ કે તેના કુટુંભીજનોએ તેના પાપમાં લાગ્યોડાર થવાની હા પાડે તો પણ એ શક્ય હતું ? કુદરતનો નિયમ છે કે તમારું પાપ તમે કોગવો પરંતુ આવી બધી સહેલી-સરળ વાતો આપણું વિચારતાં નથી અને પછી હાયવોય અને જગતસ કરીએ છીએ.

“આપણે આપણુંને મહા લાગ્યાશાળી અમ. જવાં લેઈએ કે સુખી થવાની સુંદર વાતો આપણુંને કોઈ તાજુ કરાવનાર હે. નહીં તો સતત પ્રગત્યમાં રહેવાથી આ ગંધાં રહ્યાંને વિસ્મૃત થઈ જય એ રવાલાવિડ હે. પરંતુ એ વિસ્મૃતિમાંથી સુકૃત કરાવનાર કોઈદ હે. બોટલાં આપણા સાલકમોં, બેટલાં આપણાં આખ્ય હે કે આપણુંને આ વાતની સતત કોઈ યાહ આપે હે. અને યાહ આપવા હતાંય ન જેતીએ તો પછી એમ જ કહેવું પડે ને કે “હોણ ન દેશો અમને રામ”.

પૂછયશીના પ્રવચન બાદ સૌ શુકુભાઈએનોએ પોતાનાં નામ સ્વર્ઘસેવક ભાઈને લખાવી દીધાં. ત્યારણાં સૌ પ્રસાદી લઈને છૂટાં પછ્યાં છૂટાં પડતી વખતે સૌના સુખ પર બરાબર જેસાં વર્ષના દિવસે જ સાંલગ્ના ભગેર આ પ્રવચનના કારણે પ્રસન્નતાનાં દર્શાન થતાં હતાં.

૫૩

ચોણી

સંકલન : ડેમંટ મહેતા

આચારણ-૮ (૪૬) કર્મ કરનારાઓથી ચોણી શ્રેષ્ઠ છે, તપસ્વીઓએ કરતાં ચોણી શ્રેષ્ઠ છે અને જાનીઓથી પણ ચોણી શ્રેષ્ઠ છે, માટે હે અગ્રેન ચોણી થા.

(૪૭) સર્વ ચોણીઓમાં પણ ને શ્રદ્ધાવાન ચોણી મારામાં દીન થયેલા અંતરાભા વડે મને નિરંતર ભજે છે તેચોણી મને અતિશ્રેષ્ઠ માન્ય છે.

(૪૮) હે પાર્થ ! તે પુરુષનો આ દોકમાં તેમજ પરસોક્તમાં પણ વિનાશ થતો નથી કેમકે શુલ કર્મ કરનારો કોઈપણ હુર્ણીતને પામતો નથો.

(૪૯) ચોગભ્રષ્ટ પુરુષ પુષ્ટયવાનોના (સ્વર્ગીદિ) ઉત્તમ લોકોને પામી ત્વાં ઘણ્યાં વર્ષો સુધી રહીને સહાચારી-થીમંતના ઘરમાં જન્મે છે.

(૫૦) અથવા જાનવાન ચોણીના જ કુળમાં જન્મે છે અને દોકમાં ને આ પ્રકારનો જન્મ છે એ ખરેખર અતિ હુર્બંદ છે.

(૫૧) હે કુદુનંદન, તે પુરુષ ત્વાં, તે પૂર્વ-દેહમાં સાધન કરેલા સમયુદ્ધોળના સંસ્કારોને ખર્ચે છે અને તેના પ્રભાવથી તે કરીને ભગવતું પ્રાપ્તિરૂપ ચિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.

(૫૨) કેમકે તે ચોગભ્રષ્ટ પુરુષ અસંયમી હોવા હતાં પણ તે પૂર્વના અભ્યાસ વડે પુષ્ટ તરફ પેંચાય છે જ. કેમકે ને સમયુદ્ધીરૂપ ચોણીને ક્રિત જિજ્ઞાસુ પણ હોય તો તે વેદમાં કહેલાં સકામ કરીન ચોળ વી જય છે.

(૫૩) અનેક જન્મોનાં પુષ્ટયથી અંત : કરણુંની શુદ્ધિને પામેરો અને અતિ પ્રયત્નથી અભ્યાસ કરનારો ચોણી સંપૂર્ણ પાપાથી જાણી નીતે શુદ્ધ થઈ, તે સાધનાના પ્રભાવથી પરમ ગતિને પામે એમાં કહેવું જ શું ?



* પુ. યોગબિક્ષુજીના સાંનિદ્યમાં એક હિવસ *

(માઉન્ટ આણુ સુકામે)

પ્રવીષુ શાહ

માઉન્ટ આણુ ઉપર દેલવાડાના દેરાથી યોએ
કર - લાલમંહિર - એક સુંદર અને રણિયામણું
સ્થળ છે. મંહિરની જગ્યામાં પ્રવેશતાં જ પહેલાં
મહાદેવનું મંહિર આવે અને મંહિરથી યોડા
યોડા અંતરે અલગ અલગ ટેકરીઓ. ઉપર ગેડા
ધારના બંગલા કેવાં મકાનો - ચારે પાણુંએ
વનરાજીના કુંડ, આશ્રમ કેવી વિશાળ, શાંત
અને પવિત્ર જગ્યામાં પ. પુ. ગુરુદેવ શ્રી યોગ-
બિક્ષુજીની સેવામાં એક હિવસ માટે રહેવાનું
સૌભાગ્ય મને મળ્યું. ખૂબ જ હૃતાર્થ થયો.

સવારે સાડા જ વાગ્યે ત્યાં પહેલાંથ્યો. ગુરુ-
દેવશ્રી ધ્યાન-સાધનામાં હતા. લગભગ સાડા સાત
વાગ્યે પ્રાતઃસ્મરણીય પ. શ્રી ગુરુદેવનાં દર્શાન
થયા. ખૂબ આનંદ થયો. અમદાવાદથી હું કે
રૂપાલ લાવ્યો હતો. તે પૂજયશ્રીને આપી. પૂજય-
શ્રીએ અધાના. કેમકુશળ પૂજયા, અને જરૂરી
સૂચનાઓ. આપી પ્રાતઃપૂજા માટે ઇમમાં ગયા.
ત્યાં સુધીમાં શ્રી નવીનભાઈ (મહારાજ) અને
હું નાહિયાઈને પરવાર્થ. યોડા મંત્રાય કર્યો.
લગભગ સાડાદસ વાગ્યે શ્રી ગુરુધ્યાનબિક્ષુજીના
આઈ શ્રી નવીનભાઈ કુદુંબ પરિવાર સાથે પુ.
ગુરુદેવને મળવા આવ્યા. ધાર્યો આધ્યાત્મિક વાતો
થઈ. અડ્યો-પોણો. કલાક રોકાઈને તેઓ સૌ
ગયા.

નોજન ઈત્યાદિ પતાવીને યોડાએ આરામ
કર્યો. એપોરે ત્રણેક વાગ્યે પૂજયશ્રીએ મને તથા
મહારાજને જોલાવ્યા. પૂજયશ્રીને ઉતારો હતો
તે બંગલાથી યોડે ફર જીંચા ખડક ઉપર ધીમું
એક મકાન હતું. પૂજયશ્રીની સાથે ત્યાં જવાનું
હતું. આસ્તું જીંચું અને ગરૂપદું ચઢાય યથીને

અમે ઉપર પહેલાંથ્યા. નાણુ-ચાર ઇમતું ગેડા ધાર્યા
સુંદર મકાન હતું. પૂજયશ્રીએ મહારાજ પાસે
તાજું જોલાવીને પાસાણું ઉઘાડયું. આગળ મોટો
યોરડો હતો. યોરડાની વચ્ચમાં એક લાકડાના
પદ્મં ઉપર ગાડાયું-ચાહુર તથા ચિત્તાનું ચામડું
પાથરેણું હતું અને તેનો ઉપર પુ. સ્વામી શ્રી
શ્રદ્ધાનંદજી મહારાજનો મોટો ફ્રાટો રાખેલો
હતો. હું અહો આતીને આનંદવિદોરથી ગયો.
પુ. સ્વામી શ્રદ્ધાનંદજીના દર્શન કર્યો.

પુ. ગુરુદેવ પાસેથી જાણુવા મળ્યું કે પુ.
સ્વામી શ્રી શ્રદ્ધાનંદજી મહારાજ ઊરકાશીના
ખાન મોટા સંત હતા. તેમના વિષે ધણી ચમત્કા-
રીક વાતો થતી હતી. અથવે આ લાલમંહિરની
જગ્યામાં શ્રી અલેહાનંદજી મહારાજ રહે છે.
તેઓ સ્વામી શ્રદ્ધાનંદજીના શિષ્ય છે. શ્રદ્ધાનં-
દજી આ સ્થાનમાં ધોણો સમય રહ્યા હતા; અને
અહીં આ યોરડામાં ગેરીને પૂજા-ધ્યાન-સાધના
ઇત્યાદિ કરતા હતા તથા આશ્રમ કેવી આ
વિશાળ જગ્યાનું સંચાલન કરતા હતા. આ
તેમતું નિવાસસ્થાન હતું. બીજી ત્રણેક ઇમોમાં
પૂજય સ્વામીજીની કેટલીક વસ્તુઓ રાખેલી હતી;
પુ. સ્વામીજીનાં પરરણા, વિશ્રૂણ, હંડીસ્વા-
મીના હાથમાં હોય છે તેવી એક લાકડી, યોડાં
પુસ્તકો વગેરે. પુ. શ્રી ગુરુદેવે આ બધી વસ્તુઓ
અમને રસપૂર્વક બતાવી. બધા ઇમોમાં ઇસીને
પાછા અમે મુખ્ય ઇમમાં આવ્યા. સ્વામીજીના
ફ્રાટ સામે પૂજયશ્રીએ ખુરશીમાં સ્થાન લીધું.
આગળનું પાસાણું પાથે કરીને હું અને મહારાજ
નીચે આસન પાથરને ગેડા. પૂજયશ્રીએ કહું
“આને આપણે અહીં ધ્યાન કરીશું. સૌ પ્રથમ

ओम् परिवारनी प्रथुववंहना ज्ञातीशु” अने पट्ठी “ओम् शुद्ध ओम्” के गायत्रीमंत्र अथवा के ठीक लागे ते मंत्र मनमां ज्ञातीने पट्ठी ध्यान कृ-पानु” छे. अत्यारे साडा वाणि वाण्या छे; लगभग एक ठबाक ध्यान करीशु.”

अमे सत्य-धर्म् शुद्धेवनी ज्य ज्ञातीने प्रथुववंहना ज्ञात्या अने पट्ठी मनमां मंत्रमाप करता करता ध्यानमां जेडा. प.पू. शुद्धेव श्री योगभिक्षुल्लना सांनिध्यमां, परम शांत अने पवित्र वातावरणमां ध्यान करवने। अति आनंदायक अवसर मण्ये. खूण ज आनंद थये. लगभग एकाह ठबाक बीती गये। तेनी पथ अपर ना खड़ी. ध्यानमुक्त थया बाह पूज्यश्रीने कहु “प्रवीषुभार्द! तमे खूण नस्ती-वाहर छे. आजथी हवे अमे केटवा हिवस अहीं रहीशु” तेटवा हिवस रोज अहीं जेसीने ध्यान करीशु. आजे पहेला ज हिवसे तमने अमारी साथे अनेना लाभ मण्ये.” अपर, शुद्धल्लनी कुपा अपर पार छे.

पांचठ वाण्ये अमे नीत्रे आव्या. श्री नवीन-बाई अने तेमने। परिवार, ठाकेर जवानुं हेवाथी पू. शुद्धेवना हर्षनाथे आव्या हता. पूज्यश्रीने कहु “यादो आपणे स्वामी श्री अलेहानंदल पासे जर्दने जेसीने.” अमे सौ अलेहानंदल पासे जर्दने योसीमां जेडा; स्वाध्याय कर्या. नवीनबाई ठाकेर जवा नीकण्या. त्यारे लगभग साँझना साडा छ वाण्या हता.

पूज्यश्रीने इरवा जवानो समय थये। हतो तेथी पूज्यश्रीनी साथे देलवाडानां देहां तरह अमे चालवा मांडयु. चालतां चालतां देरासरना सुण्य हरवाजनी ठाणी जानुये आवेला मेहान पासे

‘काई उपर आधार नहीं राखवायी आजाही अने आगाही तरह
जवाशे’ ए समरण सारी छे, पछु ‘जे ज स्थिति आजाही अने आगाहीनी
छे’ ते समरण साची छे.

—योगभिक्षु

आव्या. पू. श्री मेहानमां एक ठेकाहे योगी क्षण भाटे योग्या. पट्ठी भने कहु “जुओ, त्यां पेवा चातरे। देखाय छे त्यां कृपवृक्षनां ये जाऊ छे. तेनी जाशुमां रहेला जोईमांतुं लभाण वांचीने कृपवृक्षनां दर्शन करीने पाछा आवेला त्यां सुधी अमे अहीं जिबा छीयो.”

पूज्यश्रीने नभस्कार करीने हुं चातरा पासे गये। जोईमां लजेलुं लभाण वांचयुं—“हवेला अने हानवोये व्यारे समुद्रमध्यन कर्युं त्यारे तेमांथी योह रत्ने। नीकण्यां हतां तेमांतुं छहुं रत्न ते आ कृपवृक्ष; तेनी आगण जिबा रहीने ने काई इच्छा करीयो ते इण्णीलूत थाय छे तेली मान्यता छे....” लभाण वांचीने मेरे कृपवृक्षना दर्शन कर्या। दर्शन करी पूज्यश्री पासे पाछा आव्या. त्यांथी लालमहिर पाछा आव्या त्यारे आरतीनो समय थहर्या गये। हतो. पू. शुद्धेव साथे अमे महिरना योक्तमां जिबा रह्या. श्री अलेहानंदल्लये आरती हतारी।

रातना वाणु-पाण्यि पतावीने पूज्यश्री साथे अलेहानंदल पासे आवीने जेडा. दुर्गरानी निस्व शांतिमां योगभिक्षुल अने अलेहानंदल्लये ज्ञानगेष्ठि करी. योग-ज्ञानमार्ग-वेदांत-शक्ति. पात अने मंत्रविज्ञान विषे धर्षी वातो सांख्यवानो अभूत्य लाभ मण्ये। मननी सात्त्विकता, पवित्रता अने प्रसन्नतामां खूण ज वधारे थये। रात्रे अमारा हतारे जर्द सूर्य गये।

ठीके हिवसे सवारे साडासात वाण्ये पू. श्री शुद्धेव योगभिक्षुल्लना आशीर्वद लहर्ने अमहावाह आववा नीकण्यो। भाउन्ट आयु उपर पूज्यश्रीना सांनिध्यमां पसार करेलो। एक हिवस दमेशां पाद रहेशे।



व्लेश, कर्म, कर्मों के फल और वासनाओं से विमुक्त ऐसा' विशेष चेतन (वे ही एक मात्र) आश्वर हैं। आश्वर संपूर्ण सर्वज्ञ हैं। आश्वर त्रिकालिन गुरुओं के भी गुरु हैं; काल से अन का छेदन-भेदन नहीं हो सकता। आश्वर का नाम प्रणव (ओम्-अ॒) है। ओम् का मार्यक जप करने से आत्मसाक्षात्कार होता है और अन्तरायों का अभाव हो जाता है।

* द्रष्टव्या उद्देश :-

- (१) सर्व व्यापक परम सूक्ष्म चेतनतत्त्व के ज्ञेन्तुं नाम प्रथम (ओम्-अ॒) छे तेनी प्रतीति अहुजन-समाजने करववा प्रयत्न करवो। (२) व्योग्यने। प्रयार, प्रसार अने संशोधन करवा प्रयत्न करवो। (३) समाजतुं नीतिक धैरखु उंचु लाववा भाटे आध्यात्मिक ज्ञानने। सार्वज्ञ द्वारा प्रयार अने प्रसार करवाने। प्रयत्न करवो। (४) आ उपरांत 'अहुजननहिताय-अहुजनसुभाय'ने लगतां कार्यो लेवां के कैणवशी, तभी भी सारवार वज्रे करवा भाटे प्रयत्न करवो।



આધુનિક સાહિત્યના તથા
આધુનિક વડા પ. પુ.
ગુરુદેવ શ્રી ચોગલભણ

To.

પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :-

એમાંથુણે પ્રેમસાહુલાલભણ પરિવાર રૂએ
૧/અ, પલિયનગર સોસાયટી, સેન્ટ કેવિયર્સ સ્કૂલ રોડ,
નારથુપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.

(રજિ. નં. પ/૪૪૧૬ તા. ૧૧-૫-૮૧)
 { આએ ની પણ ૮૦-૭૦ નં. ચોચ કૃ - |||
 ૩૩-૧૧૭/૮૮-૬૦ માય ૧૯૮૨ સંધી }

હતુમાન જ્યંતિ નિમિતે

સ્વાધ્યાય-સત્તસંગ-મિલન

સ્થળ : ઝાંઝરી, બાયક રોડપર, હણેગામથી આગળ,
તા. ૧૫-૪-૬૦ રવિવારે
સવારે ૮-૦૦ થા ૫-૦૦

લખાજમ દર :-

વાર્ષિક સંક્ષય (ભારતમાં)	રૂ. ૧૦-૦૦
આજીવન સંક્ષય „	રૂ. ૨૦૦-૦૦
વાર્ષિક સંક્ષય (પરદેશમાં)	૧૦ ડાલર
આજીવન સંક્ષય „	૨૦૦ ડાલર

લખાજમ મોકલવાનું સ્થળ :-

(૧) ડા. સોમાલાઈ એ. પટેલ

૧/અ, પલિયનગર,
સેન્ટ કેવિયર્સ હાઇસ્કૂલ રોડ,
નારથુપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.

(૨) નૈથદ સી. વ્યાસ

૩, ગંગાધર સોસાયટી, રામબાગ પાછળ,
મણીનગર, અમદાવાદ - ૩૮૦ ૦૦૮

મુચ્યના : (૧) લખાજમ ચેક દ્વારા અથવા મની-
ઓફિચ દ્વારા "એ. એ. પો. પ્રસ્ટ" ના નામે
મોકલવું સાથે આપનું પૂરું નામ અને
સરનામું શુદ્ધ અક્ષરોમાં લખી મોકલવું
(૨) ને સંક્ષયનાં રહેણાણનાં સ્થળ
બદલાયાં હોય તેમણે તેમના નવા
રહેણાણનું પૂરું સરનામું લખી મોકલવું
નેથા વ્યવસ્થાપકોને આંક મોકલવામાં
સરળતા રહે.

(૩) "કુતમ્ભરા" ને લગતો પત્રબ્યવહાર
નીચેના સરનામે ફરવો.

શ્રી નૈથદલાઈ સી. વ્યાસ

૩, ગંગાધર સોસાયટી, રામબાગ પાછળ,
મણીનગર, અમદાવાદ - ૩૮૦ ૦૦૮.

૫. પુ. ગુરુદેવ શ્રી ચોગલભણનું સાથેનાં
સંસ્કરણા તથા પ્રેરક પ્રેસંગો આવકાર્યછે.